All Items on https://archive.org/details/realpatidar
realpatidar.com
Full Library on https://realpatidar.com/library

KJ 187

॥ૐ॥

લિ. વિરાણી. તા. ૬/૩/૪૬

[illegible] ફાગણ સુદ ૩ બુધવાર ના રોજે [illegible]

[illegible] જાહેર સભા [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

| [illegible]
| [illegible]
| [illegible]
| [illegible]
| [illegible]

| [illegible]
| [illegible]
| [illegible]

[illegible]

| [illegible]
| [illegible]
[illegible]

[illegible]

| [illegible]
| [illegible]
| [illegible]
| [illegible]
| [illegible]
| [illegible]

| [illegible]

| [illegible]

[illegible]

[illegible]

| [illegible]
| [illegible]

realpatidar.com

https://archive.org/details/bk1055/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 1.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v7.py

https://archive.org/details/bk1055/page/n2/mode/1up

Real Patidar
Unravel Truth
Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2026.02.20 16:34:53 +05'30'

KJ 187

॥ ૐ ॥

realpatidar.com

ગ્રા. વિરાણી તા. ૬/૩/૪૬

આજ સં. ૨૦૦૨ના ફાગણ સુદ ૩ બુધવાર ના રોજ [illegible] સવારે
શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ ના ૧ જાહેર સભા બોલાવવામાં
આવેલ તે તે [illegible] પ્રમુખ કાર્ય કર્યું [illegible] રતનશી ભાઈ [illegible]
પ્રમુખ [illegible] [illegible] [illegible]
સમાજ ના સભા ના પ્રમુખ તરીકે [illegible]
ઠરાવ પાસ થયા - ટેકો — [illegible]

ઠરાવ [illegible] રતનશી ભાઈ [illegible] ટેકો [illegible]

| જુના [illegible]
| પ્રમુખ [illegible] સ્વાગત
| [illegible]
| સમાજ [illegible]
| [illegible]
| [illegible]

પ્રમુખ ~~[illegible]~~ [illegible] રતનશી [illegible]

| [illegible]
| [illegible]
[illegible]

શ્રી રતનશી [illegible]

| [illegible]
| પ્રમુખ [illegible] સ્વાગત
| [illegible]
[illegible]
| [illegible]
[illegible]
| [illegible]
[illegible]

| [illegible]

| [illegible]

પ્રમુખ [illegible]

[illegible]

| [illegible]
| [illegible]

realpatidar.com

realpatidar.com

૨

। પ્રચારક પર ના. [illegible] શકે પેદા છે તેના [illegible]—
આ. શાંતિ. [illegible] છે. — [illegible] છે - [illegible]
। પ્રચારક પેદા. ગુજરાતમાં ના. [illegible] છે. તે [illegible] છે
। આપણા શાસ્ત્રોમાં ~~[illegible]~~ [illegible] [illegible] [illegible]
। સનાતન [illegible] ગુજરાત [illegible] [illegible] [illegible] નહિ
તે માટે. [illegible] ગુજરાત
। હિન્દુ ધર્મ ના પ્રચારક શાસ્ત્રોમાં [illegible].—
। [illegible] [illegible] નામ

[illegible] [illegible] [illegible]

[illegible] નો [illegible]—
। પ્રચારક. હિન્દુ. ધર્મ. ના. [illegible] કર. તેના માટે પ્રચારક
[illegible]. પુરુષ. તૈયાર. કરવા.
। [illegible] ને કહ્યું કે રાખવા.
પછીથી રાખી ને સુધારા તોડી પાડવા તેના માટે છે તે દરેક
પ્રચારક પર. તેના પર [illegible] શાસ્ત્ર ના સુધારા તોડી
પાડવા—
। દરેક ગામમાં સુધારા: ~~[illegible]~~ [illegible] પડ્યા. છે.
। પ્રચારક [illegible] [illegible] [illegible] [illegible] [illegible]

[illegible] [illegible]. નાગપુર——

। [illegible] [illegible]. [illegible]
। [illegible]. [illegible] [illegible] [illegible] [illegible]
। શાંતિ. [illegible] [illegible] આપણા પૈસા [illegible]
। [illegible] ના. આદમી ——
। શાંતિ [illegible] [illegible] [illegible] [illegible] તેનું [illegible] કરવો
। [illegible] તેને [illegible] [illegible]
।

realpatidar.com

https://archive.org/details/bk1055/page/n4/mode/1up
-Virani Sanatani Meeting (1055)

KJ 188

realpatidar.com

[illegible]

[illegible]	[illegible]
[illegible]	[illegible]
[illegible]	[illegible]
[illegible]	
[illegible]	[illegible]

| [illegible]

| [illegible]

| [illegible]

| [illegible]

[illegible]

| [illegible]

| [illegible]

| [illegible]

| [illegible]

| [illegible]

| [illegible]

| [illegible]

| [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

realpatidar.com

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

https://archive.org/details/bk1055/page/n5/mode/1up

૪

realpatidar.com

ઠરાવ નહી [illegible]

[illegible]

રતનશી [illegible]

હિન્દુ ધર્મ [illegible]

૧	હિન્દુ ધર્મ માટે ·	નારાયણ ભગત રતનશી	૫	૧૧
૧	" "	કાનજી ભાઈ	૫	૫
૧	" "	લાલજી માવજી	૫	"
૧	" "	હરજી હીરજી પરસોત્તમ	૫	"
૧	" "	નાનજી [illegible]		"
"	" "	રામજી ભાઈ [illegible]	૫	"
"	" "	ધનજી નાનજી	૫	"
૧	" "	નાનજી ભાઈ માવજી	"	"
૧	" "	નથુ ભાઈ પ્રેમજી	"	"
૧	" "			

[illegible] — [illegible]

realpatidar.com

https://archive.org/details/bk1055/page/n6/mode/1up

realpatidar.com

KJ 189

આપણું દીન શોધવાનું તેમાં બહુ સંકટો પણ પડશે તેને
શરુઆતમાંહારો મનુષ્ય શું નથી કરતા જ્યારે તેજ વાપરવા
બળ શકે છે કુળ કરવા જરૂર વધુ થાશો છે
ખરા શોધક બનો એજ મારી નમ્ર વિનંતિ છે ઘણો ગામ
સંકટ આવશે જે ચુકવું સંકટો આગળ પડી ચાલીને
કરી આગળ પડો ને સામળા ગાંગજી રામજીભાઈ

realpatidar.com